

B.Com. Semester - 3 (CBCS) Examination
December.-2020 [NEW COURSE]
Accounting-3(Elective)

Time: 1:30 Hours

Marks: 42

Instructions:

1. Figure to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

પ્રશ્ન.1 માધુરી લિ.ની નીચેની માહિતી પરથી અધિક નફાની રીતથી પાંચ વર્ષની ખરીદીના ધોરણે અધિક (14) નફાની રીતથી પાઘડીની ગણતરી કરો.

વિગત	રૂ.
10,000 ઇક્વિટી શેર દરેક રૂ.100નો	10,00,000
રૂ.100નો એક એવા 10%ના 3,000 પ્રેફરન્સ શેર	3,00,000
નફાનુકસાન ખાતું (જમા બાકી)	58,000
સામાન્ય અનામત	52,000
લેણદારો	1,25,000
દેવીફૂંડી	45,000
પ્રોવિડન્ટ ફંડ	80,000
છેલ્લા ચાર વર્ષનો કુલ નફો (60% લેખે આવકવેરો ગણ્યા પહેલાનો)	18,00,000
રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર	8%
આ ધંધામાં રોકાયેલી મૂડી પર જોખમનો દર	2%

ધંધામાં રોકાયેલ કુલ મિલકતો નીચે પ્રમાણે વહેંચાયેલ છે.

કાયમી મિલકતો – કુલ મિલકતોના 70%

ચાલુ મિલકતો – કુલ મિલકતોના 25%

અવાસ્તવિક મિલકતો – કુલ મિલકતોના 5%

કાયમી મિલકતોની બજારકિંમત તેમની ચોપડા કિંમત કરતાં 30% વધારે છે. જ્યારે ચાલુ મિલકતોની ચોપડે કિંમત રૂ.25,600 વધારે ગણવામાં આવી છે.

પ્રશ્ન.2 નીચે આપેલી માહિતીના આધારે 31-03-2020ના પૂરા થતા વર્ષ માટે મહેસૂલી ખાતું તૈયાર કરો. (14)

વિગત	રૂ.
શરૂઆતની બાકી – 50% લેખે ચાલું જોખમ માટે અનામત	1,80,000
વધારાનું અનામત	36,000
અંદાજીત દાવા અંગેની જવાબદારીની શરૂઆતની બાકી	31,000
અંદાજીત દાવા અંગેની જવાબદારીની આખરની બાકી	42,000
દાવાઓની ચૂકવણી	3,65,000
કાનૂની ખર્ચા	6,000
પુનઃવીમાની વસુલાત	32,000
મેડીકલ ખર્ચ	4,000
ઘાલખાદ્ય	800

પ્રીમીયમ વસૂલાત	4,86,000
સ્વીકૃત પુનઃવીમા પ્રીમીયમ	32,000
સુપરત પુનઃવીમા પ્રીમીયમ	43,000
ડાયરેક્ટ બીઝનેસ કમિશન	48,600
સ્વીકૃત પુનઃવીમા કમિશન	1,600
સુપરત પુનઃવીમા કમિશન	2,150
વહીવટી ખર્ચા	90,000
વ્યાજ, ડિવિડન્ડ, ભાડું વગેરે	24,000
રોકાણ વેચાણનો નફો	3,000

વર્ષના અંતે વર્ષના પહેલાં દિવસ જેટલી અનામત બનાવો.

પ્રશ્ન.3 એક ટ્રાન્સપોર્ટ કંપનીના હિસાબોમાંથી એપ્રિલ 2020ની નીચેની વિગતો મળે છે. (14)

શક્ય કામકાજના દિવસો	26
ખરેખર કામકાજના દિવસો	22
થયેલ મુસાફરી (કિલોમીટર)	880
ટ્રીપની સંખ્યા	33
વહન કરેલ જથ્થો (ટન)	330
વર્ષ દરમિયાન કામકાજના અંદાજી દિવસો	275
એપ્રિલ 2020 માટે વાહનના ખર્ચાઓ:	
પેટ્રોલ/ઓઇલ/ગ્રીસ	રૂ.300
ડ્રાઇવરનો પગાર માસિક	રૂ.200
ક્લિનરનો પગાર માસિક	રૂ.100
2020ના વર્ષનો ટાયર, સમારકામ નિભાવ	
અને અન્ય ખર્ચ	રૂ.2720
મિકેનિકનો માસિક પગાર	રૂ.100
સ્થિર ખર્ચ 2020ના	
મૂડી ખર્ચ	રૂ.21,600
ભંગાર કિંમત	રૂ.રૂ.1,600
ઉપયોગી જિંદગી	5 વર્ષ
2020નો વહીવટી ખર્ચ	રૂ.5500

ટન કિલોમીટરની અને દૈનિક પડતરની ગણતરી કરો.

પ્રશ્ન.4 તા. 01/03/2020 ના રોજથી મે. સાહિલ બ્રધર્સનો ચાલુ ધંધો ખરીદી લેવા માટે તા. 01/07/2020 ના રોજ સાવન લિ. ની સ્થાપના કરવામાં આવી. ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર તા. 01/08/2020 ના રોજ મળેલું હતું. કંપનીના પ્રથમ હિસાબો તા. 31મી ડિસેમ્બર 2020 ના રોજ તૈયાર કરવામાં આવશે. નીચેની વિગતો પરથી નોંધણી પહેલા અને નોંધણી પછીનો નફો કે નુકસાન દર્શાવતું તૈયાર કરો. (14)

વિગત	રૂ.	વિગત	રૂ.
કાચોનફો	1,80,000	તા. 31/08/2020 સુધીનું ભાડું	7,200
વેચાણ ખર્ચ	9,900	તા. 31/08/2020 પછીનું ભાડું (વાર્ષિક)	24,000
પગાર ખર્ચ	20,000	રાજકીય પક્ષને દાન	8,400
મુસાફરી ખર્ચ	3,600	ધંધાના સંચાલન બદલ સાહિલ બ્રધર્સને કમિશન	5,000

સામાન્ય ખર્ચ	4,000	ઘાલખાદ્ય	1,800
ડિરેક્ટર ફી	15,000	ઘાલખાદ્ય અનામત	3,000
ઘસારો	12,000		
પ્રાથમિક ખર્ચ	5,000		

કુલ વેચાણ રૂ. 12,00,000 હતું. જેમાનું રૂ. 4,00,000 નું વેચાણ 1લી જુલાઈ 2020 પહેલાનાં સમયનું હતું.

પ્રશ્ન.5 ટ્રેકનોંધ લખો. (કોઈપણ બે)

(14)

1. પાઘડીને અસર કરતાં પરિબલો
2. સેવા પડતર પધ્ધતિના લક્ષણો
3. સ્થાપના પહેલાંનો નફો
4. અપેક્ષિત વળતરનો દર અને અપેક્ષિત નફો

ENGLISH VERSION

Q.1 From the following information of Madhuri Ltd. Find goodwill by five years purchase of super profit. (14)

Particulars	Rs.
(1) 10,000 Equity shares each of Rs. 100	10,00,000
(2) 10% 3,000 Preference share capital Each of Rs. 100	3,00,000
(3) P & L A/c (Credit)	58,000
(4) General Reserve	52,000
(5) creditors	1,25,000
(6) Provident Fund	80,000
(7) Bills Payable	45,000
(8) Last Four year profit (Before 60% tax Provision)	18,00,000
(9) Normal rate of return on capital Employed	8%
(10) Risk return rate on Capital Employed	2%

Fictitious assets are 5% of total assets while fixed assets are 70% of total assets and current assets are 25%

The market value of fixed assets are 30% more than their book value. While the book value of current assets are of Rs. 25,600 more than their market value.

Q.2 Prepare Revenue Account of the business from the following details for the year ended dated 31-03-2020 (14)

Particulars	Rs.
Opening Balance of Reserve for unexpired risk @50%	1,80,000
Additional Reserve	36,000
Opening Balance of Estimated liabilities for claims	31,000
Closing Balance of Estimated liabilities for claims	42,000
Claims Paid	3,65,000
Legal Expenses	6,000
Re-insurance Recoveries	32,000
Medical Expense	4,000
Bad debts	800
Premium Recovered	4,86,000
Premium on Re-insurance Accepted	32,000
Premium Re-insurance Ceded	43,000
Commission on Direct business	48,600
Commission on Re-insurance Accepted	1,600
Commission on Re-insurance ceded	2,150
Administrative Expenses	90,000
Interest, dividend, Rent etc.	24,000
Profit on sale of Investments	3,000

Create reserve at the end of the year to the same Extent as on first day of the year.

Q.3 Following Particulars are taken from accounts of a transport company for a month April, 2020. (14)

Possible working days	26
Actual working days	22
Journey performed (kms)	880
No. of trips	33
Quantity transported (in ton)	330
Annual Estimate of working days	275
Expenses of Vehicles during April-2020	
Petrol, Oil and Greece	Rs.300
Driver's salary (monthly)	Rs.200
Cleaner's salary (monthly)	Rs.100
Maintenance (for 2020)	Rs.2720
Mechanic's salary (monthly)	Rs.100
Fixed Expenses During 2020	
Capital Expenditure	Rs.21,600
Scrap Realization	Rs.1,600
Useful Life	5 years
Adm. Exp. (2020)	Rs.5,500

Calculate Cost Per ton Kilometre and Per day.

Q.4 Savan Ltd. was incorporated on 01-07-2020 to Purchase exiting business of M/s. Sahil Brothers with effect from 01-03-2020. The certificate of commencement of business was received on 01-08-2020. First final Accounts of the company will prepared on 31st Dec.2020. Prepare statement showing profit or loss prior to and after incorporation from the information given below. (14)

Particulars	Rs.	Particulars	Rs.
Gross profit	1,80,000	Rent up to 31-08-2020	7,200
Sales Expenses	9,900	Rent after 31-08-2020 (annual)	24,000
Salary Expenses	20,000	Donation to political party	8,400
Travelling Exp.	3,600	Commission to Sahil brothers for management of business	5,000
General Exp.	4,000	Bad-debts	1,800
Director fee	15,000	Bad-debts Reserve	3,000
Depreciation	12,000		
Preliminary Exp.	5,000		

Total sales were Rs.12,00,000 out of which sales of Rs.4,00,000 were for period before 1st July-2020.

Q.5 Write a short notes. (Any two) (14)

- (1) Factors affecting to goodwill.
- (2) Characteristics of Operating Costing.
- (3) Profit before incorporation.
- (4) Expected Rate of Return and Expected Profit.
